

M.Com Semester - 3 (CBCS) Examination
OCT/NOV-2024 (AS PER SYLLABUS YEAR JUNE-2024)
Advanced Cost & Financial Accounting (Ele-2 (New-23))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન. ૧ બુદ્ધ કંપનીનું અંદાજપત્ર મુજબનું ઉત્પાદન 10,000 એકમોનું છે, પણ ખરેખર ઉત્પાદન 12,000 (20) એકમોનું થયું છે. જે પૈકી 9,000 એકમોનું વેચાણ થયું છે. એકમદીઠ વેચાણ કિંમત રૂ. 200 નક્કી થઈ છે.

પડતર અંગેની વિગતો નીચે મુજબ છે :

પ્રત્યક્ષ માલસામાન એકમદીઠ	રૂ. 60
પ્રત્યક્ષ મજૂરી એકમદીઠ	રૂ. 30
કારખાના ખર્ચ (ચલિત) એકમદીઠ	રૂ. 10

સ્થિર ખર્ચ :

કારખાના સંબંધી	રૂ. 2,00,000
વહીવટી સંબંધી	રૂ. 1,00,000
વેચાણ વિતરણ	રૂ. 60,000

ખરેખર વેચાણ આવક પર 5% કમિશન આપવાનું છે.

સમાવેશી પડતર પદ્ધતિ મુજબ અને સીમાન્ત પડતર પદ્ધતિ મુજબ નફો દર્શાવતું પત્રક તૈયાર કરો.

અથવા

પ્રશ્ન. ૧ નીચેની માહિતી જય ગુરુદેવ મેન્યુફેક્ચરીંગ કંપની લી.ની ઉત્પાદન ને લગતી માહિતી આપેલ છે.

વિગત	2021-22	2022-23
પડતર (રૂ.)	8,20,000	11,20,000
નફો કે નુકસાન (રૂ.)	(-20,000)	80,000

ગણતરી કરો :-

- | | |
|----------------------------|---------------------------------------|
| 1) વેચાણ | 5) રૂ. 15,00,000 ના વેચાણે સંભવિત નફો |
| 2) નફા-જથ્થાનો ગુણોત્તર | 6) રૂ. 80,000 ની ખોટે સંભવિત વેચાણ |
| 3) સ્થિર ખર્ચ | 7) વર્ષ 2022-23 માટે સલામતી ગાળો |
| 4) સમતુલ બિંદુ (રૂપિયામાં) | |

પ્રશ્ન. ૨ RC કંપની લિમિટેડ સંકલીત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે. નીચેના વ્યવહારોમાંથી (20) આમનોંધ લખો

ક્રમ	વિગત	રકમ રૂ.
1	માલસામાનની ઉધાર ખરીદી	10,00,000/-
2	માલસામાનની ખરીદીનો ખર્ચ	25,000/-
3	ઉત્પાદન વિભાગને આપેલ પરોક્ષ માલસામાન	5,00,000/-
4	માલસામાનનો સામાન્ય બગાડ	500/-
5	સ્ટોર્સમાંથી વેપારીને માલસામાન પરત	5,000/-
6	એક ઉત્પાદન પરથી બીજા ઉત્પાદન પર માલસામાનની ફેરબદલી	25,000/-

7	પરોક્ષ મજૂરી	9,000/-
8	ઉત્પાદન ખાતે લઈ જવામાં આવેલ પ્રત્યક્ષ મજૂરી	10,000/-
9	સામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી	2500/-
10	પ્રત્યક્ષ ખર્ચા ચૂકવ્યા	7,500/-
11	ઉત્પાદન ખર્ચા ચૂકવ્યા	60,000/-
12	કારખાના ખર્ચા ફાળવ્યા	10,000/-
13	વેચાણ અને વિતરણ ખર્ચ ચૂકવ્યો	12,500/-
14	તૈયાર માલ	15,000/-
15	રોકડ વેચાણ	30,000/-
16	કાચો નફો	1,25,000/-
17	મશીનરી પર ઘસારો	4,000/-
18	લેણદારને રોકડા ચુકવ્યા	20,000/-
19	ઘાલખાધ	2,000/-
20	દેવાદારો પાસેથી રોકડા મળ્યા	1,00,000/-

અથવા

પ્રશ્ન. ૨ ભાવિન કંપની લિમિટેડના પડતરના હિસાબો પરથી નીચેની માહિતી અને વ્યવહારો લીધેલ છે. કંપની સંકલીત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે..

તા. 01-04-2022ના રોજ બાકીઓ:

શેરમૂડી	: રૂ. 5,00,000/-
લેણદારો	: રૂ. 5,00,000/-
દેવાદારો	: રૂ. 2,00,000/-
બેંક સિલક	: રૂ. 75,000/-
પ્લાન્ટ	: રૂ. 5,75,000/-
સ્ટોક	: રૂ. 1,50,000/-

વર્ષ દરમિયાનના વ્યવહારો નીચે પ્રમાણે હતા:

વિગત	રકમ રૂ.
પ્રત્યક્ષ મજૂરી ચૂકવી	6,50,000/-
માલસામાનની ખરીદી	10,00,000/-
ઉત્પાદન માટે માલ આપ્યો	10,50,000/-
ઉત્પાદન ખાતે ફાળવેલ પ્રત્યક્ષ મજૂરી	6,00,000/-
કારખાના ખર્ચા ચૂકવ્યા	3,00,000/-
કારખાના ખર્ચા ફાળવ્યા	2,25,000/-
વેચાણ-વિતરણ ખર્ચા ચુકવ્યા	1,00,000/-
પડતર કિંમતે તૈયાર માલનું ઉત્પાદન	18,00,000/-
વેચાણ	22,00,000/-
માલસામાન (તા. 31-3-2022)	95,000/-
તૈયાર માલનું આખરસ્ટોક	95,000/-
લેણદારો ચુકવ્યા	11,00,000/-
ગ્રાહકો પાસેથી મળ્યા	21,00,000/-

તા. 31-03-2023 ના રોજ જરૂરી ખાતા અને કાચું સરવૈયુ તૈયાર કરો.

પ્રશ્ન. ૩ દિશાંત કંપની લિમીટેડ બિનસંકલિત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે. નિચેના વ્યવહારોમાંથી (15) આમનોંધ લખો

ક્રમ	વિગત	રકમ રૂ.
1	માલસામાનની રોકડ ખરીદી	5,00,000/-
2	ઉત્પાદન માટે માલસામાનની ખરીદી	2,50,000/-
3	માલસામાનનો અસામાન્ય બગાડ	1,250/-
4	જોબ પરથી માલસામાન સ્ટોર્સમાં પરત	5,000/-
5	માલસામાનનું વેચાણ	25,000/-
6	ચુકવેલ કુલ મજૂરી	16,000/-
7	મરામત માટે મોકલેલ માલસામાન	2,500/-
8	અસામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી	1,500/-
9	ગ્રાહકો પાસેથી રોકડા મળ્યા	22,500/-
10	વહીવટી ખર્ચ ચૂકવ્યો	30,000/-
11	વહીવટી ખર્ચ ફાળવ્યો	3,000/-
12	વિતરણ ખર્ચ ફાળવ્યો	2,000/-
13	વેચેલ માલની પડતર	60,000/-
14	ઉધાર વેચાણ	50,000/-
15	ચોખ્ખો નફો	40,000/-

અથવા

પ્રશ્ન. ૩ ચુવરાજ કંપની લિમીટેડ બિનસંકલિત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે. તા. 01-04-2022 ની કેટલીક બાકીઓ નીચે મુજબ

વિગત	ઉધાર રૂ.	જમા રૂ.
ચાલુ કામ ખાતાવહી નિયંત્રણ ખાતું	2,08,000/-	-
તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતું	92,000/-	-
કારખાના શિરોપરી ખર્ચ ખાતું	2,000/-	-
વહીવટી શિરોપરી ખર્ચ ખાતું	1,200/-	-
માલસામાન ખાતાવહી નિયંત્રણ ખાતું	46,000/-	-
સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતું	-	3,49,200
	3,49,200	3,49,200

વર્ષ 2022-23 દરમિયાનના વ્યવહારો :

વિગત	રકમ રૂ.
પ્રત્યક્ષ મજૂરી	3,00,000/-
પરોક્ષ મજૂરી	30,000/-
કારખાના પરોક્ષ ખર્ચ	58,000/-
વહીવટી પરોક્ષ ખર્ચ	46,800/-
ઉત્પાદન ખાતે વસુલ કરેલ કારખાના ખર્ચ	88,000/-
ઉત્પાદન ખાતે વસુલ કરેલ વહીવટી ખર્ચ	48,000/-
ઉત્પાદન માટે આપેલ માલસામાન	1,96,000/-
વર્ષ દરમિયાન થયેલ તૈયાર માલની પડતર	7,20,000/-

વેચેલ માલની પડતર	7,60,000/-
માલસામાનની ખરીદી	2,00,000/-
કારખાનામાં મરામત માટે મોકલેલ માલસામાન	8,000/-
ઉત્પાદન માટે પુરા પાડેલ માલસામાનનું આવક માલ ગાડાભાડું	3,200/-
વેચાણ	8,40,000/-

કંપનીના પડતરના ચોપડામાંથી મેળવેલ ઉપરોક્ત માહિતી પરથી પડતર ખાતાવહીમાં જરૂરી ખાતા અને તા. 31-03-2023 ના રોજ કાચું સરવૈયું બનાવો

- પ્રશ્ન. ૪ (A) બેંચ માર્કિંગ એટલે શું? બેંચ માર્કિંગના પ્રકારો સમજાવો (08)
 (B) બેલેન્સ સ્કોર કાર્ડના ફાયદા અને મર્યાદાઓ વર્ણવો (07)
 અથવા

- પ્રશ્ન. ૪ ટ્રેક નોંધ લખો
 (A) આંતર પેઢી તુલનાના ફાયદા અને મર્યાદા (08)
 (B) સમાન પડતર પદ્ધતિના હેતુઓ (07)

ENGLISH VERSION

Que.1 Buddha Company's budgeted production is 10,000 units, but actual production is 12,000 units. Out of which 9,000 units have been sold. Selling price per unit Rs. 200 has been decided. (20)

The details regarding the cost of product are as follows:

Direct Goods per unit	Rs. 60
Direct Labour per unit	Rs. 30
Factory cost (Variable) per unit	Rs. 10

Fixed Expenses:

Related to factory	Rs. 2,00,000
Related to administration	Rs. 1,00,000
Sales Distribution	Rs. 60,000

Commission is payable at 5% on Actual sales revenue.

Prepare a profit sheet showing the profit according to the inclusive method and according to the marginal method.

OR

Que.1 The following information is related to production of Jay Gurudev manufacturing company ltd

Particulars	2021-22	2022-23
Cost (Rs.)	8,20,000	11,20,000
Profit or loss (Rs.)	(-20,000)	80,000

Calculate: -

- 1) Sales
- 2) P/V Ratio.
- 3) Fixed expenses.
- 4) Break-even point (In Rupees)
- 5) Probable profit on sales of Rs. 15,00,000
- 6) Probable sales at a loss of Rs. 80,000
- 7) Margin of safety for the year 2022-23

Que.2 RC Co. Ltd. keeps their accounts by Integrated accounting system. Write journal entries from the following transactions

(20)

Sr.No	Particulars	Rs
1	Credit purchase of material.	10,00,000/-
2	Expenses For purchase of material.	25,000/-
3	Indirect material given to production	5,00,000/-
4	General wastage of material.	500/-
5	Material Returned to supplier.	5,000/-
6	Material transfer from one production to another Production	25,000/-
7	Indirect Labour	9,000/-
8	Direct Labour transfer to production	10,000/-
9	Wages for normal Ideal time.	2500/-
10	Direct expenses paid	7,500/-
11	Production overhead paid	60,000/-
12	Factory overhead absorbed	10,000/-
13	Selling and Distribution overhead paid.	12,500/-
14	Finished goods	15,000/-
15	Cash sales	30,000/-
16	Gross Profit	1,25,000/-
17	Depreciation on machinery	4,000/-
18	Cash paid to Creditors	20,000/-
19	Bad Debts	2,000/-
20	Cash received from Debtors	1,00,000/-

OR

Que.2 The following information and transactions have been taken from Bhavin co.ltd Cost accounts. The company maintains integral accounting system.

Balances as on 01-04-2022:

Share capital	: Rs. 5,00,000/-
Creditors	: Rs. 5,00,000/-
Debtors	: Rs. 2,00,000/-
Bank Balance	: Rs. 75,000/-
Plants	: Rs. 5,75,000/-
Stock	: Rs. 1,50,000/-

Transactions during the year were as under:

Particulars	Amount Rs.
Direct labour paid	6,50,000/-
Materials purchased	10,00,000/-
Materials issued for production	10,50,000/-
Allocation of Direct labour for production	6,00,000/-
Factory expenses paid	3,00,000/-
Allocation of Factory overhead	2,25,000/-
Selling & Distribution expenses paid	1,00,000/-
Finished Production at Cost	18,00,000/-
Sales	22,00,000/-
Material (Dt. 31-3-2022)	95,000/-
Closing Stock of Finished goods	95,000/-
Payment to Creditors	11,00,000/-
Receipt from Customers	21,00,000/-

Prepare necessary control account and trial balance as on Dt. 31-03-2023

- Que.3 Dishant Company Ltd. keeps their accounts by Non-Integral Accounting system. Write Journal entries from the following transactions. (15)

Sr. No	Particulars	Rs.
1	Cash purchase of material	5,00,000/-
2	Purchase of material for production	2,50,000/-
3	Abnormal Loss of material	1,250/-
4	Material Returned from Job	5,000/-
5	Sale of Material	25,000/-
6	Total Labour Paid.	16,000/-
7	Material issued for repairing	2,500/-
8	Wages of Ideal in Abnormal	1,500/-
9	Cash received from Customer	22,500/-
10	Administration overhead paid	30,000/-
11	Office overhead Allocated	3,000/-
12	Distribution overhead absorbed	2,000/-
13	Cost of goods sold	60,000/-
14	Credit sales	50,000/-
15	Net profit	40,000/-

OR

- Que.3 Yuvraj Company maintains Non-integral accounting system. The following information on 01-04-2022 Some balances were:

Particulars	Debit Rs	Credit Rs
Work in progress Ledger control A/c.	2,08,000/-	-
Finished goods Ledger Control A/c.	92,000/-	-
Factory overhead A/c.	2,000/-	-
Administrative overhead A/c.	1,200/-	-
Stores Ledger control A/c.	46,000/-	-
General Ledger Control A/c.	-	3,49,200
	3,49,200	3,49,200

Transactions during the year 2022-23 were as under.

Particulars	Debit Rs
Direct wages	3,00,000/-
Indirect wages	30,000/-
Factory overheads	58,000/-
Administration overheads	46,800/-
Factory expenses recovered in production A/c	88,000/-
Administration expenses recovered in production A/c	48,000/-
Material issued for production	1,96,000/-
Cost of Finished goods during the year	7,20,000/-
Cost of goods sold	7,60,000/-
purchase of material	2,00,000/-
Material issued for factory for repairing	8,000/-
Cartage inward of the materials issued for production	3,200/-
sales	8,40,000/-

Prepare necessary accounts in the Cost Ledger from the above information received from the cost ledger of the company and also prepare Trail Balance as on 31-03-2023

- Que.4 (A) What is Bench Marking? Explain the types of Bench Marking. (08)
(B) Describe advantages and Limitations of Balanced Score Card (07)

OR

- Que.4 Write on Short note:
(A) Benefits and Limitations of Inter-Firm comparison (08)
(B) Objectives of uniform costing (07)
